

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના પ્રાદેશિક કાઉન્સિલર રોવેના સેન્ટોસ (Rowena Santos) FCM નાં 2020-2021 માટેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ચૂંટાયા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 15, 2020) – આજે, ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીસ (FCM) દ્વારા ઘોષણા કરવામાં આવી કે બ્રેમ્પટનના પ્રાદેશિક કાઉન્સિલર રોવેના સેન્ટોસ (Rowena Santos) એક વર્ષના સમયગાળા માટે [ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીસ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ચૂંટાયા છે](#).

ડાયરેક્ટરની ચૂંટણીઓ ઓક્ટોબર 5-7 વચ્ચે થઈ અને આજે FCM ની વાર્ષિક સાધારણ સભામાં ચૂંટણીને બહાલી આપવામાં આવી.

FCM વર્ષ 1901 થી કેનેડાની મ્યુનિસિપલ ગવર્નમેન્ટનો રાષ્ટ્રીય અવાજ બની રહ્યું છે. તેના સભ્યોમાં કેનેડાના શહેરો અને ગ્રામ્ય સમુદાયોથી માંડીને, ઉત્તરી સમુદાયો અને 20 પ્રોવિન્સિયલ અને ટેરિટોરિયલ મ્યુનિસિપલ એસોસિએશનો સુધીની, બધાં કદોની 2,000 ઉપરાંત મ્યુનિસિપાલિટીસનો સમાવેશ થાય છે. સાથે મળીને, તે એક દરિયાકાંઠાથી બીજા દરિયાકાંઠાથી અન્ય દરિયાકાંઠા સુધીના 90 ટકાથી વધારે બધાં કેનેડિયનોનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર કેનેડામાંથી મ્યુનિસિપલ આગેવાનો મુખ્ય મુદ્દાઓ પર FCM નીતિ નક્કી કરવા દર વર્ષે ભેગા થાય છે.

બ્રેમ્પટનની સીટી કાઉન્સિલની કામગીરીઓ અને [કાઉન્સિલની અગ્રતાનો સમયગાળો](#) એક દરિયાકાંઠાથી બીજા દરિયાકાંઠાથી અન્ય દરિયાકાંઠા સુધીની ઘણી કેનેડિયન મ્યુનિસિપાલિટીસને પ્રતિબિંબિત કરે છે, જેમાં પરવડી શકે તેવા આવાસો, ટ્રાન્ઝિટ, આબોહવાલક્ષી કાર્યો, વિવિધતા ઉજવવી અને જાતિવાદ-વિરોધી નીતિનો અમલ કરવો, અને અર્થતંત્રને સુરક્ષિતપણે ફરીથી વેગવંતુ બનાવવા ધંધાઓ અને સમુદાયોને COVID-19 સહાયતા કરવાનો સમાવેશ થાય છે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટનનો વિકાસ એક ગ્રામ્ય નગરમાંથી, એક પરા (પેટા-શહેરી) સમુદાય તરીકે થયો છે, અને હવે કેનેડામાં નવમી સૌથી વિશાળ મ્યુનિસિપાલિટી તરીકે એક ગતિશીલ શહેરી કેન્દ્રમાં ફેરવાઈ રહ્યું છે. અન્ય ઘણી મ્યુનિસિપાલિટીસની જેમ, તેના પ્રવાસમાં અમે ઘણાં પડકારો સહ્યા છે, અને તે સહવાનું ચાલુ છે પણ અમે તેની સાથે સાથે ઘણું શીખ્યા છીએ. આપણે સૌ સેવા આપીએ છીએ તે રહેવાસીઓ માટે ઉકેલો વહેંચવા અને સાથે મળીને વક્રીલાત કરવા દેશભરના સાથી મ્યુનિસિપલ આગેવાનો સાથે FCM નાં બોર્ડ પર બેસવું એક સન્માનજન્ય અને અધિકારભર્યું છે. હું મારી બાંધો ચડાવવાની આશા રાખું છું અને અમે બ્રેમ્પટન, અને આપણાં બધાં નગરો અને શહેરો માટે વક્રીલાત કરવા શક્ય એટલા બધાં કાર્યો કરી રહ્યાં છીએ. આપણાં નગરો અને શહેરો આબાદ થાય ત્યારે, આપણો દેશ સમૃદ્ધ થાય છે.”

– રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન

“ઘણાં વર્ષોથી FCM દ્વારા કેનેડિયન સમુદાયોની જરૂરિયાતો માટે વક્રીલાત કરવામાં અતૂટ ભૂમિકા ભજવવામાં આવી છે. કાઉન્સિલ વતી, મને ગૌરવ છે કે આ ક્ષમતામાં આપણાં શહેરને સેવા આપવા કાઉન્સિલર સેન્ટોસને ચૂંટવામાં આવ્યા છે અને મને વિશ્વાસ છે કે તેણીની સક્રિયતા અને કટિબદ્ધતાથી ખાતરી થશે કે બ્રેમ્પટનવાસીઓ અને પીલ રીજીયનના રહેવાસીઓનો અવાજ સાંભળવામાં આવે, અને તેનાથી આપણાં સમુદાયને રોજ અને દરરોજ પ્રભાવિત કરતા અસરકારક પરિણામો મળે.”

– પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca